

To,  
Corporate Relations Department,  
Bombay Stock Exchange, PJ Towers,  
Dalal Street, Mumbai - 400001,  
Maharashtra, India

**Scrip Code:** 540063

**Subject:** Newspaper Clippings of Advertisement published in Newspaper(s)


Dear Sir/ Ma'am,

We are submitting herewith the clippings of advertisement(s) published in Free Press Gujarat and Lokmitra for Intimation of 11<sup>th</sup> Annual General Meeting of the Company of the Company for the Financial Year 2020-2021.

The above is for your information and record.

Yours Faithfully.

For **ECS Biztech Limited**



Geetika Bisht  
Company Secretary  
ACS 48713

Date: 08.09.2021  
Place: Ahmedabad

ECS Biztech Limited.

**Regd. Office:** The First, B02, ECS Corporate House, Behind Keshavbaug Party Plot, Off. 132 ft Ring Road, Vastrapur, Ahmedabad- 380015. Gujarat. India.

Phone: 8980005006 / 8980004000 | Web: [www.ecscorporation.com](http://www.ecscorporation.com)

CIN: L30007GJ2010PLC063070

# Gujarat reports 14 COVID-19 cases, no death



Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

Small solar projects: 2,605 applications for one-time exit in Gujarat

**DISHA RESOURCES LIMITED**  
REGD. OFFICE: 3, Rajesh Apartment, B/H, Ajanta Comm. Estate Off Ashram Road, Ahmedabad-380014.  
PHONE: (079) 27540990, 27543060  
E-MAIL: info@aaci.co.in CIN: L74110G31995PLC024869  
www.aaci.co.in

**NOTICE OF 26th ANNUAL GENERAL MEETING E-VOTING & BOOK CLOSURE INFORMATION**  
Notice is hereby given that:  
1. The 26<sup>th</sup> Annual General Meeting (AGM) of the Company will be held on Thursday, 30<sup>th</sup> September, 2021, at 11:30 A.M. at the Registered office of the Company situated at 3, Rajesh Apartment, B/H, Ajanta Comm. Estate Off Ashram Road, Ahmedabad - 380014 for transacting the business as set out in the Notice of the Meeting dated August 13, 2021.  
2. Electronic copies of the Notice of the AGM and Annual Report for the financial year 2020-21 have been sent to all the members holding shares on September 3, 2021, whose email IDs are registered with the company's Depository Participant(s). These documents are also available on the website of the company at [www.aaci.co.in](http://www.aaci.co.in) and on the websites Central Depository Services (India) Limited (CDSL) at [www.evotingindia.com](http://www.evotingindia.com) and website of Bombay Stock Exchange (BSE) at [www.bseindia.com](http://www.bseindia.com). The Notice of AGM and Annual Report have been sent to all other members at their registered address in the permitted mode. The dispatch of Notice of AGM has been completed on September 07, 2021.  
3. Members holding shares either in physical form or dematerialized form, as on the cut-off date (September 23, 2021), may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through electronic voting system of the Central Depository Services (India) Limited (CDSL) at a place other than the venue of the AGM ('remote e-voting'). All the members are informed that:  
I. The business as set forth in the Notice of the AGM may be transacted through voting by electronic means;  
II. The remote e-voting shall commence on: Monday, 27<sup>th</sup> September, 2021 (9:00 a.m.);  
III. The remote e-voting shall end on: Wednesday, 29<sup>th</sup> September, 2021 (5:00 p.m.);  
IV. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM shall be on September 23, 2021.  
V. E-voting by electronic mode shall not be allowed beyond 5:00 p.m. IST on September 29, 2021;  
VI. Any person who acquires shares of the company and becomes a member of the company after dispatch of the notice of the AGM and holding shares as on the cut-off date i.e. (September 23, 2021), may obtain the login ID and password by sending a request at [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) / [ahmedabad@linkintime.co.in](mailto:ahmedabad@linkintime.co.in).  
VII. Members may note that:  
a. The remote e-voting module shall be disabled by Central Depository Services (India) Limited (CDSL) beyond 5:00 p.m. IST on September 29, 2021 and once the vote on a resolution is cast by the member, the member shall not be able to modify the vote.  
b. The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again;  
c. Only persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail facility of remote e-voting or voting at the AGM.  
VIII. The Notice of AGM is available on the Company's website [www.aaci.co.in](http://www.aaci.co.in) and also on the Central Depository Services (India) Limited (CDSL) website [www.evotingindia.com](http://www.evotingindia.com).  
IX. For e-voting instructions, the members may go through the instructions in the Notice of AGM and in case of queries/grievances relating to e-voting by electronic means, the members may refer the frequently asked questions (FAQs) and e-voting user manual available at [www.evotingindia.com](http://www.evotingindia.com), under Help section or write an email to [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) or [ahmedabad@linkintime.co.in](mailto:ahmedabad@linkintime.co.in) or contact Ms. Pankti Thakkar, Company Secretary & Compliance Officer, at 3, Rajesh Apartment, B/H Ajanta Comm. Estate, Off Ashram Road, Ahmedabad-380014, email id: [info@aaci.co.in](mailto:info@aaci.co.in), Phone No. 079-27540990, 27543060.  
4. The notice is further given that Pursuant to the Provisions of Section 91 of the Companies Act, 2013 and in compliance with the rules and regulations (Management and Administration) Rule, 2014, the register of members of the Company will remain closed from 24<sup>th</sup> September, 2021 to 30<sup>th</sup> September, 2021 (both days inclusive).

**FOR, DISHA RESOURCES LIMITED**  
PANKTI THAKKAR  
COMPANY SECRETARY & COMPLIANCE OFFICER  
(ICSI MEMBERSHIP NO:48258)

Place : Ahmedabad  
Date : 07.09.2021

**ECB BIZTECH LIMITED**  
CIN: L30007G21010PLC063070  
Registered Office: B-02, The First, ECS Corporate House behind Keshavnagar Park, Off 132 Ft. Road, Vastrapur, Ahmedabad 380015.  
Contact: [secretarial@ecsbiztech.com](mailto:secretarial@ecsbiztech.com)  
Mob: +91 9898000000

**NOTICE OF 11TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING**  
Notice is hereby given that 11th Annual General Meeting (AGM) of ECB Biztech Limited will be held on Thursday, 30th day of September, 2021 at 4:00 PM, at registered office and parallelly at 2:00 PM, ECS Corporate House behind Keshavnagar Park Plot, off 132 Ft. Road, Vastrapur, Ahmedabad 380015.  
The Notice of 11th AGM setting out the business to be transacted at the meeting and the annual Report of the Company for the FY 2020-2021 has been sent in electronic mode to the members whose email IDs are registered with the Company or the depository participant(s) and have not specifically requested for physical copies. Physical copies of the notice of 11th AGM and Annual Report have been sent to all other Members at their registered address in the permitted mode. The Notice of AGM is also available on the company's website [www.ecsbiztech.com](http://www.ecsbiztech.com).  
In accordance with Section 108 of the Companies Act, 2013 read with rule 20 of the Companies (Management and Administration) Rules, 2015 and regulation 44(1) of the SEBI (LODR) Regulation, 2015, the Company has provided its members the facility to cast their vote electronically on all the resolution set forth in the Notice.  
The notice is given that pursuant to provisions of Section 91 of the Companies Act, 2013 read with rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of SEBI (LODR) Regulation 2015, the register of members and share transfer book of the Company will remain closed from 20.09.2021 to 29.09.2021 (both days inclusive) for the purpose of 11th AGM of the Company.  
The details as required by aforesaid provision are given hereunder:  
1. Date and time of commencement of remote e-voting: Monday, 27th September, 2021 at 9:00 AM  
2. The remote e-voting shall end on Wednesday, 29th September, 2021 at 5:00 PM  
3. A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e., 23rd September, 2021 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the AGM.  
4. Any member who acquires shares of the Company and become member of the Company after the dispatch of notice of the AGM should follow the same procedure for the e-voting as mentioned in the notice of the Company.  
5. Voting through remote e-voting shall not be allowed beyond 5:00 PM on Wednesday, 29th September, 2021. The e-voting module shall be dispatched by NSDL for voting thereafter.  
6. The facility of voting through ballot paper shall be made available at the AGM.  
7. The members who have casted vote prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again.  
8. For electronic voting instructions, members may go through the instructions in the notice of 11th AGM and in case of any queries/grievances connected with electronic voting, members may refer the frequently asked questions (FAQs) and e-voting user manual for shareholders available at the HLP section of [www.evoting.com](http://www.evoting.com) or may write to [evoting@india.com](mailto:evoting@india.com) or can contact to the company Secretary of ECB Biztech Limited at [secretarial@ecsbiztech.com](mailto:secretarial@ecsbiztech.com)  
9. The Company has appointed Mr. Gautam Virsadiya, practising Company Secretary (CP No: 19866) as the Scrutinizer to Scrutinize the remote e-voting and ballot process in a fair and transparent manner.  
The results on the resolutions shall be declared within 48 working hours of the conclusion of the AGM. Results declared along with the Scrutinizer's report shall be placed on the website of the Company [www.ecsbiztech.com](http://www.ecsbiztech.com).

**FOR, ECB Biztech Limited**  
Viraj Mandora  
(Managing Director)  
DIN: 00328792

Place : Ahmedabad  
Date : 07.09.2021

**1st 'textile parcel' special train flagged off from Surat in Gujarat to Bihar**

Ahmedabad: The first 'textile parcel' special train having 25 new modified goods wagons customised to carry textile material left from here in Gujarat to Bihar with an aim to boost Surat's textile market through an economical, faster and safer mode of transport, Western Railway officials said on Sunday, Minister of State for Railways and Textiles Darshana Jarosh flagged off the train on Saturday from the Udhna New Goods Shed in Surat for Danapur near Patna and Ram Dayal Nagar near Muzaffarpur in Bihar, the Western Railway (WR) said in a release. 'Textile traffic has been loaded for the first time in customised NMG (new modified goods) wagons at the Udhna New Goods Shed. In this direction, the textile parcel special train, consisting of 25 NMG wagons, was run for the first time from the Udhna New Goods Shed carrying textile material to Patna and Muzaffarpur,' said the release. 'As far as Gujarat is concerned, over 4.91 crore doses of the vaccines have been administered in the state on Sunday until 4 pm. According to the data compiled by the Union health ministry, over 68.46 crore COVID-19 jabs have been administered in the country so far. Of it, over 71.61 lakh people were vaccinated on Sunday. As far as Gujarat is concerned, over 4.91 crore doses of the vaccines have been administered in the state until Sunday.

**VIVANTA INDUSTRIES LIMITED**  
CIN: U74110G321013PLC075393  
Reg. office: 403/T5,Sarthik II, Opp. Rajpath Club, S.G Highway, Bodakev Ahmedabad -380054  
Phone No.: 079- 26870952  
Website: [www.vivantaindustries.com](http://www.vivantaindustries.com)  
E-mail: [business@vivantaindustries.com](mailto:business@vivantaindustries.com)

**NOTICE OF ANNUAL GENERAL MEETING**  
NOTICE is hereby given that the Annual General Meeting (AGM) of the members of the Company will be held on Wednesday, 29th September, 2021 at 03:00 p.m. IST through Video Conferencing ('VC') / Other Audio Visual Means ('OAVM') to transact the business as set out in the Notice of AGM in compliance with General Circular Nos. 14/2020 (dated 8th April, 2020), 17/2020 (dated 13th April, 2020) and 20/2020 (dated 5th May, 2020) respectively, issued by the Ministry of Corporate Affairs ('MCA Circular(s)') and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 issued by the Securities and Exchange Board of India ('SEBI Circular') collectively referred to as 'relevant circulars' and Section 91 of the Companies Act, 2013 and as per provisions of Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the register of members and Share Transfer books of the company shall remain closed from 22nd September, 2021 to 29th September, 2021 (Both days inclusive). In compliance with MCA Circulars and SEBI Circular, the Notice of AGM along with the Annual Report for the financial year 2020-2021 have been sent in electronic mode only to all those members whose email IDs are registered with the Company or the Registrar and Share Transfer Agent or their respective Depository Participant(s).  
REMOTE E-VOTING: In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members, the facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means on all the businesses set forth in the Notice of the AGM through the remote e-voting Services provided by NSDL. The detailed instructions for remote e-voting facility are contained in the Notice of the AGM which has been sent to the Members. The details pursuant to the provisions of Companies Act, 2013 and Rules are given hereunder:  
1. Cut-off date for the purpose of remote e-voting is 21st September, 2021.  
2. Period of e-voting: E-voting shall commence from 9:00 a.m. on 26th September, 2021 and ends at 5:00 p.m. on 28th September, 2021. Please note that remote e-voting will not be allowed beyond the above mentioned time and date.  
3. Persons who have acquired shares and become member of the Company after dispatch of Notice of the AGM and holding shares as on the cut-off date i.e., 21st September, 2021, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of AGM.  
4. A person, whose name appears in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on cut-off date only, shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM. However, if the person is already registered with NSDL for remote e-voting, then the existing User ID and Password can be used for casting votes.  
5. Members attending AGM through VC/OAVM facility, who have not casted their votes by remote e-voting shall be able to cast their votes through e-voting at the AGM.  
6. Members who have casted their votes by remote e-voting, may also attend the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their votes again at the AGM.  
7. The procedure for e-voting, attending the AGM through VC/OAVM facility and registration of E-mail ID by shareholders has been provided in the Notice of AGM. The same is available on the website of the Company: [www.vivantaindustries.com](http://www.vivantaindustries.com), website of Central Depository Services (India) Limited at [www.evotingindia.com](http://www.evotingindia.com) and at the website of BSE Limited: [www.bseindia.com](http://www.bseindia.com).  
8. In case of any query relating to e-voting, members/beneficial owners may refer the frequently asked questions and e-voting user manual available at the download section of [www.evotingindia.com](http://www.evotingindia.com) or call on toll free no.: 1800-222-5533 or send a request at [helpdesk.evoting@cdsl.com](mailto:helpdesk.evoting@cdsl.com).

**For, Vivanta Industries Limited**  
SD/-  
Parikshit  
Managing Director  
DIN: 00027820  
Place: Ahmedabad  
Date: 07.09.2021

**Change Of Name :** From Old Name : Namra Nandankumar Shah OR Namra Nandanbhai Shah, New Name : Namra Nandan Shah, Address : 403, Omdarshan apt., 7, Mahavir Society, Near Mahalaxmi Cross Roads, Paldi, Ahmedabad-380007, Gujarat (INDIA) Aff.No.: 7441, Dt.12-8-2021

**Change Of Name :** From Old Name : Paritaban Nandankumar Shah OR Paritaban Nandanbhai Shah, New Name : Parita Nandan Shah, Address : 403, Omdarshan apt., 7, Mahavir Society, Near Mahalaxmi Cross Roads, Paldi, Ahmedabad-380007, Gujarat (INDIA) Aff.No.: 7442, Dt.12-8-2021

**Change Of Name :** From Old Name : Nandankumar Kantilal Shah OR Nandanbhai Kantilal Shah, New Name : Nandan Kantilal Shah, Address : 403, Omdarshan apt., 7, Mahavir Society, Near Mahalaxmi Cross Roads, Paldi, Ahmedabad-380007, Gujarat (INDIA) Aff.No.: 7440, Dt.12-8-2021

**ariyali group to create 'Miyawaki forests' in Bilimora**

Ahmedabad: On Sunday, as many as 1,100 tree saplings of 105 different species were planted by a group of like-minded people taking step towards creating a 'Miyawaki forest' in Bilimora town of Navsari district. Bilimora town has over 70,000 population. With this, a total of 6,000 trees have been planted by members of Hariyali information group in Bilimora town in the last three years. The group aims to make the town green with increasing diversity of trees. "We adopted a well-known Miyawaki forests system to grow small forests in two big lands amid urban and industrial land. This was our first experiment in the town. We have been actively engaged in tree plantation and its protection work for the last three years and so far we have successfully raised over 6,000 trees in Bilimora. We started with 10 people and now have over a hundred volunteers," Dipesh Patel, principal, V S Patel College of Arts and Science in Bilimora, told. "We called all small groups of 10-15 people in the town and encouraged them to join and decided to work together to improve the town's green cover with different species of trees including the rare and endangered ones."

**Britannia Nutrition Foundation celebrates National Nutrition Month**

Ahmedabad, On the occasion of National Nutrition Month, Britannia Nutrition Foundation (BNF) raises its commitment to positively impact the lives of over 1 lakh beneficiaries spread across more than 300 villages & slums in 8 states of India. The foundation was setup in 2010 with a vision to partake in addressing malnutrition in children, adolescents, and women. Varun Veru, Trustee, Britannia Nutrition Foundation said, "Child malnutrition is a chronic problem in India affecting 1 in every 3 children. The lack of access to nutrition leads to impaired growth and development. As we complete 11 years, Britannia Nutrition Foundation remains steadfast in its commitment to combat malnutrition and supporting the government's vision for a 'Kupshan' (malnutrition) and Anemia Mukta' Bharat. We are now enhancing our efforts to reach out to more than 1 lakh children, adolescents and mothers, and working closely with district level authorities and other partners to augment their efforts." Over the last 11 years, BNF, in partnership with government and non government stakeholders, has undertaken several initiatives to identify and tackle the root causes of malnutrition and iron deficiency anemia specifically among children, adolescents and women. As a part of its on-going commitment, BNF, through its two flagship programs Swasth Bharat and Suposhan, is reaching 48 villages in 3 blocks, spanning 7500 households. (19-10)

**Fearing rape plaint, Surat man kills lover**

Ahmedabad: Acting on a tip off, detection of crime branch (DCB) of Surat police arrested Vinay Rai (38), a resident of Karang village in Mandvi Taluka of Surat district on Sunday in connection with the gruesome murder of a woman in Maharashtra's Nandurbar district a few days ago. According to police, Rai, who works in a factory in Karanj village near Mandvi, is a native of Khamhori village in Shivan district of Bihar. The accused is a married man and father of two children. Rai took Seeta by train to Nandurbar and duo boarded one stop before Nandurbar. He then took her to a remote location near the railway tracks where he brutally murdered her with a blade. "On August 24, a woman was found brutally murdered near railway tracks in Nandurbar district. The victim's throat was slit while the face too was cut up to cover identity and even the skin on the face was removed. Police in Nandurbar alerted Surat police after they found out that the accused and victim were both from Surat. "After we detained Rai, he confessed to the crime and told the police that he had murdered Seeta Bhagat (23), a resident of Bihar with whom he was having an affair for the past two years. He brought Seeta from Bihar to Surat 10 days ago and then came to know that Seeta had been in love with another man earlier against whom she had lodged a complaint of rape. She allegedly threatened Rai that if he would not marry her, she would lodge a complaint of rape against him too."

**VIVANZA BIOSCIENCES LIMITED**  
CIN: L24110G1982PCL000507  
Regd. Office: 403, Sarthik 2, Opp. Rajpath Club, S.G Highway, Ahmedabad-380054  
Phone No.: 9727111031,  
e-mail: [info@vivanzabiosciences.com](mailto:info@vivanzabiosciences.com)  
Web: [www.vivanzabiosciences.com](http://www.vivanzabiosciences.com)

**NOTICE OF ANNUAL GENERAL MEETING**  
NOTICE is hereby given that the Annual General Meeting (AGM) of the members of the Company will be held on Wednesday, 29th September, 2021 at 02:00 p.m. IST through Video Conferencing ('VC') / Other Audio Visual Means ('OAVM') to transact the businesses as set out in the notice of AGM in compliance with General Circular Nos. 14/2020 (dated 8th April, 2020), 17/2020 (dated 13th April, 2020) and 20/2020 (dated 5th May, 2020) respectively, issued by the Ministry of Corporate Affairs ('MCA Circular(s)') and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 issued by the Securities and Exchange Board of India ('SEBI Circular'). Pursuant to Provision of Section 91 of the Companies Act, 2013 and as per provisions of Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the register of members and Share Transfer books of the company shall remain closed from 22nd September, 2021 to 29th September, 2021 (Both days inclusive). In compliance with MCA Circulars and SEBI Circular, the Notice of AGM along with the Annual Report for the financial year 2020-2021 have been sent in electronic mode only to all those members whose email IDs are registered with the Company or the Registrar and Share Transfer Agent or their respective Depository Participant(s).  
REMOTE E-VOTING: In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members, the facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means on all the businesses set forth in the Notice of the AGM through the remote e-voting Services provided by NSDL. The detailed instructions for remote e-voting facility are contained in the Notice of the AGM which has been sent to the Members. The details pursuant to the provisions of Companies Act, 2013 and Rules are given hereunder:  
1. Cut-off date for the purpose of remote e-voting is 21st September, 2021.  
2. Period of e-voting: E-voting shall commence from 9:00 a.m. on 26th September, 2021 and ends at 5:00 p.m. on 28th September, 2021. Please note that remote e-voting will not be allowed beyond the above mentioned time and date.  
3. Persons who have acquired shares and become member of the Company after dispatch of Notice of the AGM and holding shares as on the cut-off date i.e., 21st September, 2021, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of AGM.  
4. A person, whose name appears in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on cut-off date only, shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM. However, if the person is already registered with NSDL for remote e-voting, then the existing User ID and Password can be used for casting votes.  
5. Members attending AGM through VC/OAVM facility, who have not casted their votes by remote e-voting shall be able to cast their votes through e-voting at the AGM.  
6. Members who have casted their votes by remote e-voting, may also attend the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their votes again at the AGM.  
7. The procedure for e-voting, attending the AGM through VC/OAVM facility and registration of E-mail ID by shareholders has been provided in the Notice of AGM. The same is available on the website of the Company: [www.vivanzabiosciences.com](http://www.vivanzabiosciences.com), website of Central Depository Services (India) Limited at [www.evotingindia.com](http://www.evotingindia.com) and at the website of BSE Limited: [www.bseindia.com](http://www.bseindia.com).  
8. In case of any query relating to e-voting, members/beneficial owners may refer the frequently asked questions and e-voting user manual available at the download section of [www.evotingindia.com](http://www.evotingindia.com) or call on toll free no.: 1800-222-5533 or send a request at [helpdesk.evoting@cdsl.com](mailto:helpdesk.evoting@cdsl.com).

**For, Vivanza Biosciences Limited**  
SD/-  
Bhakt G. B  
Additional Director  
DIN:02207645  
Place: Ahmedabad  
Date: 07.09.2021

**Change Of Name :** From Old Name : Nandankumar Kantilal Shah OR Nandanbhai Kantilal Shah, New Name : Nandan Kantilal Shah, Address : 403, Omdarshan apt., 7, Mahavir Society, Near Mahalaxmi Cross Roads, Paldi, Ahmedabad-380007, Gujarat (INDIA) Aff.No.: 7440, Dt.12-8-2021

